

લોક સંવાદ સેતુ ૨૦૧૬ : તાલુકો લખતર જિ. સુરેન્દ્રનગર તા ૧૯/૦૫/૨૦૧૬

પ્રશ્ન નો.	કોના તરફ થી રજુ કરવામાં આવેલ છે	પ્રશ્ન ની ટુંકી વિગત	જવાબ ની ટુંકી વિગત	નિરાકરણ કરનારા અધિકારીશ્રીના નામ અને મોબાઇલ નંબર	નિકાલ ની સ્થિતિ	જો પડતર હોય તો નિકાલની સમય મર્યાદા	રીમાર્ક્સ
૩	અનસુયાબેન જગતસિંહ રાણા, મુ:- વણા, તાલુકો- લખતર	ડાર્કઝોનમાં ખેતીવાડી નું કનેક્શન ન મળવા બાબત	સપ્ટે.-ઓક્ટો.૨૦૧૨ માં લખતર પેટાવિભાગીય કચેરી હેઠળ ડાર્કઝોન માં ખેતીવાડી વીજ જોડાણ અંગે કુલ-૧૧ અરજદારોએ અરજી કરેલ હતી.નિયમ મુજબ ડાર્કઝોન માં અગ્રતાક્રમ નક્કી કરવા ડ્રો કરવામાં આવેલ.જેમાં અરજદાર નો અગ્રતાક્રમ ૧૦ મો આવેલ.ત્યારબાદ ૧૧ અરજદારોનું સર્વે કરી જરૂરી મંજૂરી અર્થે પ્રપોઝલ વડી કચેરીને મોકલવામાં આવેલ.જેમાં બે પાંચના ગ્રુપ તથા અરજદાર ની અલગથી એકલાની પ્રપોઝલ સબમીટ થયેલ.જેમાં એક ગ્રુપ ની એચ.ટી.લાઈન-૧૩.૫ કિમી,રૂપિયા-૩૯.૯૭ લાખ,બીજા ગ્રુપ ની એચ.ટી.લાઈન-૧૮.૩૨ કિમી,રૂપિયા-૫૦.૩૭ લાખ અને અરજદાર અનસુયાબેન જગતસિંહ રાણા ની એચ.ટી.લાઈન-૯ કિમી,રૂપિયા-૩૯.૯૭લાખ ની તાંત્રિક મંજૂરી જાન્યુ-૧૪ આવેલ.ત્યારબાદ ડાર્કઝોન માં ખેતીવાડી વીજ જોડાણ અંગે ટપક પદ્ધતિ ફરજિયાત કરાતા આ તમામ અરજદારોને જરૂરી ટપક અપનાવેલ અંગેના પુરાવા રજુ કરવા જણાવેલ પરંતુ ત્રણ અરજદારો દવારા પુરાવા રજુ કરવામાં આવેલ અને વર્ષ ૨૦૧૪-૧૫ માં સોલર એજી પંપ સ્કીમ જાહેર થતા ત્રણ અરજદારો તેમાં સ્વિચ ઓવર થતા ઉપરોક્ત ગ્રુપ તાંત્રિક મંજૂરી રદ કરવી પડેલ અને અંદાજપત્ર આપી શકાયેલ નહીં.હવે કુલ ૧૧ અરજદારોમાંથી માત્ર ત્રણ અરજદારો વીજજોડાણ આપવાને પાત્ર થાય છે.જેમાં ડ્રો મુજબ અરજદાર નો અગ્રતાક્રમ ત્રીજો છે.તેમની આગળના અગ્રતાક્રમ વાળા બે અરજદારોની દરખાસ્ત મંજૂરી હેઠળ છે (એચ.ટી.લાઈન-૯.૦ કિમી,રૂપિયા-૨૫.૦૫ લાખ) જેથી તેમની મંજૂરી આવ્યા બાદ તેમને અંદાજપત્ર આપી શકાય.વધુમાં જણાવાનુંકે ઉપરોક્ત ત્રણ અરજદારોને વીજજોડાણ આપવા માટે કુલ એચ.ટી.લાઈન-૧૮ કિમી,રૂપિયા-૬૫ લાખ જેવી માતબર રકમનું કંપનીને ખર્ચ થાય તેવું છે. જેથી ઉપરોક્ત અરજદારને સોલર એજી પંપ સ્કીમ હેઠળ વીજજોડાણ લેવા વિનંતી કરવામાં આવેલ છે.પરંતુ તેઓ આ બાબતે સમંત ન થતા ઉપરોક્ત દરખાસ્ત મંજૂરી અર્થે દિવસ પાંચ માં વડી કચેરીને મોકલી આપવામાં આવશે. જે મંજૂરી આવ્યે અરજદારને વીજજોડાણ આપવા અંગેની કાર્યવાહી અંદાજપત્ર ભરપાઈ થયા બાદ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.	બી ડી બારોટ, નાયબ ઇજનેર, ૭૫૭૩૦ ૧૮૨૫૮	નિકાલ		સદર અરજદાર ને અંદાજપત્ર ડીઇ /એલએસડી/ ટેક/૧૪૬૬ તા ૩૦.૦૫.૧૬ ના રોજ અરજદારને આર્પીએડી થી મોકલી આપવામાં આવેલ છે ને સદર પશ્ચ નો નિકાલ કરવામાં આવેલ છે

પ્રશ્ન નો.	કોના તરફ થી રજુ કરવામાં આવેલ છે	પ્રશ્ન ની ટુંકી વિગત	જવાબ ની ટુંકી વિગત	નિરાકરણ કરનારા અધિકારીશ્રીના નામ અને મોબાઇલ નંબર	નિકાલ ની સ્થિતિ	જો પડતર હોય તો નિકાલની સમય મર્યાદા	રીમાર્ક્સ
૨૧	પટેલ રણછોડભાઈ મોહનભાઈ મુ:- લખતર, તા-લખતર	લખતર ગ્રામ પંચાયત માં આવતું હોવા છતાં સીટી મુજબ લાઈટ બીલ આપવા બાબત	સદર અરજદારની અરજી અનુસંધાને જણાવવાનું કે પહેલા લખતર ગામ નગર પંચાયત નો દરજ્જો ધરાવતું હતું તેથી લાઈટ બીલ નગર પંચાયત ના દરજ્જા ને ધ્યાને રાખી વીજ વપરાશના બીલો વીજ ગ્રાહકોને આપવામાં આવતા હતા પરંતુ હાલમાં લખતર ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવે છે જેથી લખતર ગ્રામ ના વીજ ગ્રાહકોને ગ્રામીય મુજબ વીજ બીલમાં જરૂરી ટેરીફ માં સુધારો તારીખ ૧૬-૦૫-૧૬ ના રોજ કરી આપવામાં આવેલ છે તથા હવે પછી સદર ગ્રાહકોનું બિલીંગ આવતા માસથી ગ્રામીય ટેરીફ મુજબ આવશે.આમ અરજદારની સદર ફરિયાદનું નિરાકરણ કરેલ છે.	બી ડી બારોટ, નાયબ ઇજનેર, ૭૫૭૩૦ ૧૮૨૫૮	નિકાલ		